

۱۱ او مر شري پرماتمني نمهه ۱۱

يٽارت گيتا (شريمد پگود گيتا)

پھريون اڏياڻ

धृતराष्ट्र उवाच
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्वैव किमकुर्वत सञ्जय ॥१॥

ڏرتراشترا او ڄاڻ

”ڏرمَ كيٽر ڪُروْ كيٽر سَمَويٽا يِيٽِتَسَوْ:
ماٽاكاهه پاندو شِڪِيو ڪِير ڪِروَت سَنْجِيه ” ()
ڏرتراشترا پچيو. ”هي سنجيه ! ڏرم كيٽر، ڪُروْ كيٽر ڦ
گڏ ٿي یڏ جي اچا رکڻ وارا منهنجا پُتر ۽ پاندو پُترين ڇا
کيو ؟

اڳيان روپي ڏرتراشترا ئ سنيم روپي سنجيه اڳيان سان
ديكيل من وارو ڏرتراشترا جنم کان انڌو آهي، پر سنججمي روپي
سنجهه دواران هو ڏسي ٿو، بدھي ٿو. هو سمجھي ٿو ته پرماتما
ئي ستيه آهي، تڏهن به جيستائين هنجوئي پيدا ٿيل موھ
روپي دريوڏن جيئرو آهي، هنڌجي درستي سدائين ڪوروں ٿي
ئي ٿكيل آهي، وڪارن ٿي ئي رهي ٿي.

شرير هڪ كيٽر آهي. جڏهن هرديه روپي ديش ڦ آتمڪ
سمپتي ملهائتي ٿيندي آهي، ته هيُ شرير ڏرم كيٽر بُلچي

ويندو آهي. ڪڙو جو ارت آهي ڪريو. اهو اکر حڪم ڏيندڙ آهي. شري ڪرشن چون ٿا: پرڪري مان پيدا ٿن گلن جي دواران بروس ٿي منش ڪرم ڪري ٿو. هو هڪ کن به ڪرم ڪرڻ بند نتا ٿين. اهي به تندريست شريرو لاءِ چڻ خوراڪ آهن. ٿئي گط (ستو گط، رجو گط ئ تمو گط) منش کي ديوتا مان ڪيڙي تائين شريرو ۾ بدنه ٿا. جيستائين پرڪري مان اُپين ٿيل گط زندھ آهن، تيستائين ڪڙو لڳو رهي ٿو. جنم مرتيو جو کيترا، وڪارن وارو کيترا ڪڙو کيترا آهي ئ پرم ڏرم پرماتما ۾ رُچي ڏيارڻ واريون پچ واريون پروريون (پاندون) جو کيترا ڏرم کيترا آهي.

تَوَدِينِ حي پنجاب ۾ ڪاشي، پرياگه ۾ ئ بین اهڙن انیڪ استانن تي ڪڙو کيترا جي ڳولها ۾ لڳل آهن، پر گيتاڪار پاڻ ٻڌايو آهي تم جنهن کيترا ۾ يد ٿي هئي، اهو ڪتي آهي.“ادڻ شري ڪوٽبيه کيترا مِنيا ڀي ڏيٽي.“ (ادياء ۱۳ پهريون شلوڪ) ”ارجن! هيءُ شري روئي کيترا آهي ئ جو هن کي جاڻي ٿو، اهو هنجو انت پائي ٿو وٺي، اهو کيترا گيه آهي.“ اڳيان هن کيترا جو وستار ٻڌايو، جنهن ۾ ڏهه اندريون، مڻ ٻڌي، اهنكار، پنجن وڪارن ئ تنهي گلن جو ورنن آهي. شري روئي کيترا آهي، هڪ ميدان آهي. هن ۾ وڙهڻ واريون پروريون به آهن، ”ديوتائين جا گط“ ئ ”راكسي گط“ پاندون جو سنتان ئ ڏرتراشترا جو سنتان ”ديوجاتي ئ وجاتي پروريون“.

انپوي مهاپرش جي شرن ۾ وجڻ سان ٻنهي پروريون ۾ سنگهرش جو نرنئه ٿيندو آهي. هيءُ کيترا ئ کيترا گيه جو ڙڪراءءِ ئ اهائي حقيقي يد آهي. وش و ڦيئن سان اتهاوس پريو پيو آهي، پر انهن ۾ ڪنط وارن کي به اندرین جيت نتي ملي هيءُ تم

هڪ بئي کان بدلي جي ڀاونا آهي. پرڪريٽي ۽ جي ڪل من کي روگي، پرڪريٽي ۽ کان پري جي شڪتي ۽ کي اجاگر ڪري ۽ اُن ۾ پنهنجو پاڻ سماڻئڻ ٿي انسان جي سچپي سوب آهي. اهائي فقط سوب آهي جنهن جي پنيان هار ڪونهي. اها ئي مكتي آهي، جنهن جي پنيان جنم مرڻ جو ٻندن ڪونهي. انهي پرڪار اڳيان کان ڇتل من سنيم دواران جاڳي ٿو ۽ چاڻي ٿو ته کيترا-کيترا گيه ۾ چا ٿيو؟ جيئن جيئن سنيم سان، ڪنترول سان من جو جاڳڻ ٿو ٿئي، تيئن هن کي آتمڪ درشتني ايندي ويندي.

سنجيٽن ده

دڙخوا تُ پاندو انیڪم ویوڙهم درِبُو ڏنِستدا
آچاريٽه مُپ سَنَگِيَه راجا وچنَمِبرُویت (۲)

اُن وقت راجا دريوڏن پاندون جي سينا کي سنجت ۾ بيٺل ڏسي دروڻاچاريٽه وٽ وڃي هي وچن چيا:-
بيائيءُ جو وهنوار ئي دروڻاچاريٽه آهي. جڏهن اسانکي جاڻ
ٿي ٿي وڃي ته اسيين پرماتما کان جدا ٿي ويا آهيون (اهو
بيائيءُ جو نشو آهي)، اُتي اُن کي پراپٽ ڪرڻ لاءِ ترق ٿي
پعدا ٿئي، تڏهن اسيين گزوءَ جي ڳولها ٿا ڪريون. بنهي پريورتن
جي وچ ۾ اهوئي پهريون گرو آهي؛ جيتويٽيڪ ان کان پوءِ ستگرو
يوگيشور شري ڪرشن ٿيندا، جو ڀوگ ۾ استتي ڪرڻ وارو هوندو.
راجا دريوڏن آچاريٽه وٽ وڃي ٿو. موهره سان پيريل دريوڏن
موهره روبي دريوڏن. موهره سڀني دکن ۽ تکليفن جي جڙ آهي،

રાજા આહી. દુર્યોદન-દુર્ મણી ડ્વોહી એ બિન કી સ્ટાઇન્ડર્, યોડન-
એ હો ડન. આત્મક સમૃતી તી ટ્કન્ડર્, સ્પ્ચી સમૃતી આહી. અન ક્ર
જો ડ્વોહે, ખામી પિદા કરી ત્વો, અહો આહી મોહે. અહો પ્રકૃતી
ડાન્હન ચ્કી ત્વો એ ગ્હેરેલ જાણ લા પરિરેઠા બે ડેટી ત્વો. મોહે આહી.
તિસ્ટાઈન પ્રેરણ જો સ્વોલ બે આહી, ને તે સ્પ્ચ કંગ્હે પૂર્ણ આહી.
ટન્હન્કરી પાંદુન જી ગ્ડ ક્લિલ સ્વીના કી ડ્સી મણી પ્છ
સાન પ્રીલ સ્જાતી ઓર્ટિન કી કન્નો તીલ ડ્સી મોહે રોપી દ્રયોડન
પ્રેરિન તી ગ્રો દ્રોણ વ્ટ ઓજી હેન ટ્રેઝ ચ્યાયો:

પશ્યાતાં પાણ્ડુપુત્રામાચાર્ય મહતીં ચમૂમ્.

વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥૩॥

પ્રશ્નીયિતામ પાંદ્વો પ્રત્નિના તામાચારિયે મહેત્તીયું ચમૂમ્,

વ્યોર્ગાહ્મ દુર્વ્યોક્ત્પત્રેણીથ ત્વો શિશ્યેણ ત્વીમતા (૩)

હી આચારીય ! પન્હન્જગી બ્ડીમાન શશ દોર્પદ-પ્ત દરશદ્યોમન
ડોરાન ગ્ડ ક્લિલ, કર્ચી ક્લિલ પાંદ્વો પ્રત્ન જી હી એ ઓડી પારી
સ્વીના કી ડ્સો.

એ જી પ્રદ એ આત્મક પ્ર ક્રી વશોસ રક્ખ વારો, દ્રદ્મન વારો એ
”દરશદ્યું“ આહી. હી એ તી પ્છ પ્રીલ પ્રિયોરન જો નાઈક આહી.
”સાદન કન્ન ને મન કર ત્યાકા.“ સાદન કન્ન ને હબ્જી, મન જી
દ્રદ્તા કન્ન ત્યેણ ગ્હરજી.
હાથી ડ્સો સ્વીના જો વ્સ્તાર :

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ ।

યુયુધાનો વિરાટશ્ર દ્રુપદશ્ર મહારથ ॥૪॥

”આત્ર શૂરા મહેષ્વાસા પ્રિમાર જુન સ્મા યેદી

યેદીનો ઓરાંશિષ્ચમ દ્રો પ્રદશ્ચમ મહારાંશમ (૪)

હેન સ્વીના ક્ર ‘મહેષ્વાસા‘-મહાન એશ્વર જો પાસ ડ્યાર્થ વારો,

ياو روپي ييم، انوراگي روپي ارجن سمان وڏو سورويں، جيئن
ساتوک روپ سچو، 'ورات' - هر طرح ايشوري ڏارا کي ڏاره
وارو، مهارشي راجا دروپد معني اچل استتي وارو جيئن
�ૃષ્કેતુશ્રેકિતનાઃ કાશિરાજશ્ચ વીર્યવાન ।

પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈવશ્ચ નરપુઙ્ગવઃ ॥૫॥

درشتڪيتو شચ્ચિકૃતાન્હ કાશિરા જશ્ચ
પુર્જત્કૃત્તૈ પ્રોજશ્ચ શચ્ચિબીશ્ચ નર્પણ્ણોહ (૫)
درشتڪيتو درદ કરતોિ، "ચ્ચિકૃતાન્હ" જતી બે ઓજી અતાન
જ્ઞત કીનંચિ પનહંગ્યી ઇશ્ત હ ઇસ્ત્ત કર્ત્તું، "કાશિ રાજ
હે" કાયા રોબી કાશીએ હ હો સુમરાત આહી. "પુર્જત્ત" એટલું,
સુકીમ એ કાર્ણ શરીર કી જિત ઢ્યાર્ણ، وારો પુર્જત્ત "હન્તી
પ્રોજ હે" ફરખન તી પ્રેપૂર ઓજીમે، મન્દિન હ સ્રીષ્ટ "શેન્દીમે"
એર આહી સચ્ચો વેનોવાર.

યુધામન્યુ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન ।
સૌભદ્રો દ્વાપદેયાશ્ચ સર્વ એવ મહારથા: ॥૬॥

યે પ્રાક્રમી "યેદામન્યો" યેદ જી લાએ મન હ ત્માર કશ્શલ
ડારાં "અત્મોજા" સનાઈ એ જો મજસ્મ, સ્પિદ્રા પ્તર આયન્યો જ્ઞદ્ધન
શ્વી આડાર એચી વિનદો આહી. તે મન બી ડ્પો ત્થી વિનદો આહી. એઝ્ઝો
શ્વી આડાર સાન એટ્પન થિલ ન્રીએ મું, ડ્યાન રોપી દ્રોપ્ડી એ જા
પંચ પણ વેન્દર્ઝ, પ્યાર વારા, કુમલ હ્રદિસ, દ્યા વારા એ પનહંગ્યી
એરાડી જા પ્કા, સ્વી જા સ્વી મહારથી આહેન. સાદાના જી રાહ તી
યોગીના સાન હ્લેટ જો હ્રકુ ગ્ને હનન હ આહી.

એઝ્ઝી ત્રખ દ્રિયોન પાંદું જી પ્કશ જા પંદરહેન વિધ નાલ
એન્હીયા, જો દ્યાયી સ્મૃતી જા ખાસ એંગ આહેન. ઓજાતી પ્રોર્ટી એ

જો રાજા હોન્ડી બે એ હો 'મોહ' એ આહી જો સજાતીયે પ્રોરતન
કી સ્માજેઠ લાં મજિબુર તો કરી, બેદી તો.
દરિવ્દન પનેન્દુકો પાસો તેમાર મંતુચર નમોની તો બેદાઈ.
જીક્દુન કા બાહ્રીન ય્દ હજી હા તે પનેન્દુજી ફુજ જો વસ્તાર
વ્દાઈ વડો કરી બેઠી હા. ઓકાર ગ્હેત બેઠાયા વિબા જો અનુન ત્યિ
સુઓ પાઠ્યી આહી, અહી નાસુંત આહેન, ફેલ પંજ સ્ત ઓકાર
બેદાયા વિબા, જન હું એન્ડર લ્કલ સ્પી બાહ્રીબુન પ્રોરતિયોન ઝાય આહી
જીએન ત્યે:

અસ્માકં તુ વિશિષ્ટ યે તાન્નિબોધ દ્વિજોત્તમ । નાયકા મમ સૈન્યસ્ય સજ્જાર્થ તાન્દ્રવીમિ તે ॥૧૭॥

અસ્મામિર તો વિશ્વિષ્ટા ય્યે તાન્નિ બોધ દ્વિજોત્તમ
નાયકા મમ સૈન્યસ્ય સજ્જાર્થ તાન્દ્રવીમિ તે (૭)
બન્ધી સ્વિનાની હું અત્મ ! એસાંજી પિકુશ હું જીકી જીકી
ખાચ આહેન, અનુન કી બે સ્માજી વથ, ડસી ચ્છ. તોહાની
જાણેલ લાં મનેન્દુજી સ્વિના જા જીકી નાયક સુરોબિર આહેન, અનુન
કી ચ્યો ત્યે:

બાહ્રીન ય્દ હું સ્વિનાપ્તિ લાં બન્ધી સ્વિનાની હું અત્મ ચેટી
પ્રકારે - બના મોચું જી બ્યી વેચાન્નો આહી. સ્યુ તે ગીતા હું
અન્તેક્રુણ જુન બે પ્રોરતિન જો પાણ હું સંગ્રહરશ આહી બ્યાચી એ
જો આજ્રુણ આહી "દ્રોણ" જીસ્તાનીન એસિન ત્યુરો બે એશૂર આરાદના
કાન એલ આહ્યોન, ત્યિસ્તાનીન પ્રકરતી એસાન ત્યે ચાનિલ આહી,
બ્યાચી બેઠી આહી. એન બ્યાચી એ ત્યે વજિબ પાણેણ જી પ્રિર્ણ પ્રહરીન
ગ્રુ દ્રુણાચારિબ માન મલ્ય ત્યે. એડોગાબરી સ્ક્યાન એ પૂરી જાણ
જી લાં પ્રિર્ણ દ્યેણ ત્યે. એટી પ્રોજીબ વર્તી એ વારો તે સુરોબરતા જો
સન્બ્રુદ્ધ ત્યીણ ત્યે ગ્રહજી.

ઓજાતીયે પ્રોરતી એ જા નાયક, સુરોબિર કિર કિર આહેન ?

ભવાન્ભીષ્મશ્ કર્ણશ્ કૃપશ્ સમિતિજ્જયઃ ।
અશ્વથામા વિકર્ણશ્ સૌમદેત્તસ્તથૈવ ચ ॥૮૧॥

યોન્યિષ્મશ્ચ્પ્ કર્ણશ્ચ્પ્ રૂપશ્ચ્પ્ સ્મિતિજ્જયઃ ।
અશ્વથામા વ્કષશ્ચ્પ્ સ્વોમદિત્તસ્તથૈવ (૮)

હુક તે પાટ (બીયાઈ જો વહનોર કર્ણ વારો દરોઠાચારિએ) આહી, પ્રરૂપી પંતામહ "પ્યિશ્મ" આહી. પ્રરૂપ અન્હન વ્કારન કુર્મ મંગહીલ. દ્ગ્રહુ સુરોવિર પ્ર ખદી આહી. અન્ત તાયીન જીએરો રહ્યી તૂ. તિરન જી સ્વિંગા ત્યિ લિટીલ હો. પો બે જન્દહે હો. એ હો આહી પ્રરૂપી રૂપી 'પ્યિશ્મ' પ્રમ પ્યાકાર્યી તાયીન રહ્યી તૂ. અન પ્રકાર સાન વ્જાત્યે કર્મ રૂપી "કર્ણ" આ સંગ્રામ કુર્મ જિત્તું વારો "ક્રપાચારિ" આહી. સાડાના ઓસ્થા કુર્મ સાડક જીયાન ક્રપા જો આચર્ણ, વહનોર કર્ણ તી "ક્રપાચારિ" આહી. પ્યાગ્વાન ક્રપા જો ડામ આહી આ પ્યાગ્વાન ક્યિ પાયેનું કાન પો સંન્ત બે એહોયી સ્રોપ આહી. સાડાના જી વ્જત જીસ્યિન એસિન અલ્ગ આહિયું, પ્રમાત્મા અલ્ગ આહી, વ્જાત્યે પ્રૂરૂત્યે જીએરી આહી - બીયાઈ જી વ્જત્યે જન્દહે આહી, મોહે રૂપી જો ગ્હેહિરો આહી. અન હાલત કુર્મ જી સાડક ક્રપા જો વહનોર, આચર્ણ કર્યુ તૂ તે હો નશ્ત તી વિન્દુ આહી. સ્વિના દ્વારા ક્યે તે કંજહે વ્જત લન્કા કુર્મ પ્રાશચ્કત કર્ણાં પ્યાસ. ઓશ્વામિત્ર દ્વારા કુમલ ત્યિ ક્યિસ પ્રત્યે ત્યિખ્યો પ્યાસ. યોગે સ્વોત્કાર મહરશી પંતન્ગલી બે એયીન તી ચ્યાં આહી, " ત્યિ સ્માડાઓપ સર્ગા વ્યાનાની સિદ્ધિયે " (૩ - ૩૭)

તકલીફ વ્જત, દક્ષ જી સ્મિ કુર્મ સંદ્યોગ પ્રગહેત ત્યિન્દ્યોન આહી. હો સ્યુ પ્યુ સંદ્યોગ આહી, પ્ર હુક પ્રમાત્મા ક્યિ પાયેનું જી રાહે કુર્મ ઓટ્રીયો ઓડા વગ્હેન આહી, જીત્રા બે કામ, ક્રૂદ, લું,

موھہ وغیره۔ گوسوامی تلسیداں جو بے اھوئی نرنیہ آهي
छोरत گرਨਥਿ ਜਾਨਿ ਖਗਰਾਯਾ। ਵਿਘਨ ਅਨੇਕ ਕਰਿ ਤਬ ਮਾਧਾ ॥
ਸਿਦ्धਿ ਸਿਦ्धਿ ਪ੍ਰੇਰਿ ਬਹੁ ਭਾਈ। ਬੁਦਿਹਿਂ ਲੋਭ ਦਿਖਾਵਹਿਂ ਆਈ ॥
(ਰਾਮਚਰਿਤਮਾਨਸ, ੭/੧੧੭/੬-੭)

”چو رت گرنت جان کگرایا! و گهن انيک کرئه تَب
مایا رِتِي سِتِي پِریئس بھو یائی! پِتھین لُوپ دکا و نہم آئی“
رام چرتمنس (۱۷۶۴-۱۷۷۴)

مايا انيڪ وگهن ڪندي آهي، درڏيون پرداان ڪري ٿي. ايتري
قدر جو سُدُ بُلائي چڏي ٿي. اهڙي اوستا وارو ساڌڪ اڳ هوند ۾ به
پرجي پوي، مرئينگ حالت وارو بيمار به اُٿي کڙو ٿيندو. هو ڀلي
ٺيڪ ٿي وڃي پر ساڌڪ جي اُن ڏيٺ جي مان جي آسري وينو ته
ختم ٿي ويندو. هڪ روڳيءَ جي جاءه تي کيس هزارين روڳه گهيري
چڏيندا، يچن چنتن جو سلسلو ابتو ٿي ويندوءَ هوڏانهن ٻهڪندي
ٻهڪندي ٿرندي ٿاپرندي پرڪرتيءَ کان پري ٿي ويندو،
جيڪڏهن ساڌڪ لکش کان پري آهيءَ ساڌڪ پاڻ تي ڪرپا
ڪري ٿو ته ڪرپا جو هڪ منو وهنوار ئي "سمِتاجيهه" سچي
سينا کي جيتي وٺي ٿو. تنھنڪري ساڌڪ کي پوري تياريءَ سان
ساودا ان رهڻ گهرجي. "دِيَا بِئْ سندت سائي، دِيَا ڪري تو آفت
آئي" پر اذوري اوستا ۾ هيءَ وجاتي پرورتي جو منجهيل، جنهن
کي سمجهي نه سگهجي، اهڙو سوروير آهي. ان طرح موھ روپي
آشوتاما، شـ ۾ گرفتار ٿيل وڪرڻءَ پرم ۾ ساهه ڪنڊڙ پورشروا
آهي. هيءَ سڀ باهرين ورتئي جي قطار جا نائڪ هئا، سوروير هئا.

अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीरिताः ।

नानाशस्त्रप्रहरणः सर्वे युद्धविशारदाः ॥१॥

”آنیمَ هَجَّ بَهْيَّهْ مُدْرَثِي تَيَّكَتْ جَيَوْتَا هَمْ“

نافا شِستَرَ پَرَهَرَ گَاهَر، سِرُويِيْ يَدَ وَشَارِدَاهَم " (٩)
 ئَبِيا بِهِ كِيتَرَائِي سورويير، گَهَطَائِي شِسَتَرَ كَلَي منهنجي لَاء
 پنهنجي جيون تان آهو كطي، اط گِنْطِيا سورويير آهن، جن كي گِئِي
 گِئِي نتو سَگَهَجِي. هَاطِي كَهَزِي سِينا كَهَزِن پَاوَن سان سرکشت
 آهي؟ ان تي چون تا -

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
 पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥१०॥

"آپرِيا پِتَّىر تَدِسِماَكِر بَلَمْ پِيشِماَپِي رَكِشَتَّىر"
 پِرِيا پِتَّىر تَوَ دَ مِيتِيشَامِر بَلَمْ پِيمِماَپِي رَكِشَتَّىر (١٠)
 پِيشِر دواران رَكِشت اسانجي سِينا هر پِرِكار سان جيتن
 سولو آهي."پِرِيا پِتَّى" ئَ "اپِرِيا پِتَّ" جهَزِا پختا ئَ منجهايندڙ
 دريوذن جي سنسي ئَ شَكِي غاهر تا ڪن. هَاطِي ڏسٹو آهي ته
 پِيم كَهَزِي طاقٽ-ٻل آهي، جنهن تي دَئُوي سِمِپِتيءَ وارا
 شِپ پاندو آسرو رکن تا، پاڙين تا.

دريوذن هَاطِي پنهنجو بندوبست، طريقو بَدَائِي تُو ته:-

अयनेषु च सर्वेषु यथामागमवस्थिता ।
 भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥११॥

"آينيشهو چ سِرُويِشنَتُو پَوَنَتَهَم سِرُوا ايو هِي
 پِيشِميو ڀي پِرِشنَتُو پِونَتَهَ سِرُوا ايو هِي" (١١)

تنهنكري سڀ مورچن تي پنهنجي جڳهه تي بيهدني سڀ
 لوڪ سڀ جا سڀ پِيشِر جي هر طرف کان بچاء ڪريو. جيڪڏهن
 پِيشِر جيئرو آهي ته اسيين نه هارائينداسين. تنهنكري توھين پاندون
 سان نه لُرِي فقط پِيشِر جو ئي بچاء ڪيو.
 كَهَزِو يودو آهي پِيشِر، جو پاڻ پنهنجي رکشا نتو ڪري
 سَگَهِي. ڪورون کي هنجي رکشا جو بندوبست تُو ڪرڻو پوي؟

હી કો બાહ્રબુન બુડો કુન્હી, પ્રાર્મ તી પીશ્મ આહી. જિસ્તાઈન પ્રાર્મ જિન્નો આહી, તિસ્તાઈન વજાતી પ્રોર્ટ્યુન (કુર્રો) અંગ જિતીલ આહે. અંગ જિતીલ જો એ હો એર્ટ કુન્હી તે જન્હેન કી જિતી તી ને સ્ગહાજી, બલ્ક અંગ જિતીલ જો એર્ટ દુર્જિહ (હાર મ્યાટ) આહી, જન્હેન કી મશ્કલાં યા કન્નાયી સાં જિતી સ્ગહાજી તો.

મહા અજય સંસાર રિપુ, જીતિ સકર્ડ સો બીર ॥

(રામચરિતમાનસ, ૬/૮૦ ક)

મહા એજિય સન્સાર રૂપ, જિતી સ્કેમ સો વિર ॥

(રામ ચૃત માનસ, ૮૦-૮૧ લે)

જિક્કદ્દેન પ્રાર્મ પૂર્વ તી વ્હિ તે એડિય વજ્દું વિજ્ઞાની હીઠ્યી તી વ્હિ. મોહે વગીર જી શકે સન્સ્કૃત કરી બ્ધગીલ આહેન, જલ્દી તી ખત્મ તી વિન્દા. પીશ્મ જી એચા મરત્યો હેઠી. એચા તી પ્રેર્મ આહી. એચા જી પૂર્તી ત્યીનું એ પ્રેર્મ જો મંત્રજી વિજ્ઞાન ગાલ્ફ સાગે ય આહી, હ્કે તી ગાલ્ફ આહી.

ઇચ્છા કાયા ઇચ્છા માયા, ઇચ્છા જગ ઉપજાયા ।

કહ કબીર જે ઇચ્છા વિવર્જિત, તાકા પાર ન પાયા ॥

એચા કાયા એચા માયા, એચા જગ ઓપ્જાયા

કહે ક્બિર જી એચા વર્જિત, તાકા પાર ને પાયા

જત્યે પ્રેર્મ નંત્ર તી એમ એપાર એ ડસ્ટેન્ચ કાન પ્રેર્મ આહી એ હો આત્મા, પ્રેર્મ આત્મા આહી. હેન શ્રેર જો કાર્ટેન એચા આહી. એચા તી માયા આહી એ એચા તી જેંપ્ટ જી જી ઓટ્પિનું એ જો કાર્ટેન આહી. ("સુ કાર્મ યેત" તદ્દેશિત બાહુસ્યામ પ્રજાયિમે એતી) (ચંદ્રોગીય ૬-૩-૩) ક્બિર ચ્યો તો જીકો એચાની કાન સ્દાનીન રહેત આહી "તનેનું જો પાર ને પાત્રો" આહી એપાર, એન્નત, એસિમ નંત્ર એપાર પ્રોવિશ પાયીન તા.

(બ્યુકામો નશકામ, આપ્તેકામ આત્મ કામો ને ત્સિમે પ્રાણી અંક્રા મન્ત્રી બ્રહ્મમની સન્મે બ્રહ્મમા પ્રીતિ) "બ્રહ્મ દાર્ઢીય ૧૪-૧૬) જીકો

ڪامنائين کان رهت آتما ۾ پوري طرح استر آهي، انجي ڪڏهن به گراوت نه ٿيندي. هو برهم سان هڪ ٿي ٿو وڃي. شروع ۾ اچائون گھڻيون ٿينديون آهن ئه انت ڏانهن جيئن وڌندو آهي. پرماتما پراپتي جي اچا ئي باقي رهندي آهي. جڏهن اها اچا به پوري ٿي ويندي آهي تڏهن اچا ئي متجي وڃي ٿي. جيڪڏهن ان کان به وڌي ڪا وستو هجتي ها تم توھين آن جي اچا ضرور ڪيو ها. جڏهن آن کان وڌيڪ ڪا وستو ئي ڪونهي تم اچا ڪنهنجي ٿيندي. جڏهن پراپت ٿيٺ ڀوگيه ڪا وستو اڻمليل نه رهنجي وڃي، تم اچا مرتيو آهي. انهي طريقي سان پيشم دواران بچاء پائيندڙ اسان لوڪن جي سينا هر طرف کان اجيء (اڳيتيل) آهي. جيستائين پرم آهي، تيستائين اوديا جو به وجود آهي پرم شانت ٿيو، تم اوديا به سمپت ٿي ويندي آهي.

پيم دوارن بچاء ڏيندڙ هنن لوڪن جي سينا جيٺ سولي آهي. پاو روپي پيم "پاوي وڊيتي ديوهه" پاو ۾ اها شكتي آهي، طاقت آهي جو اڻ ڏنل، اڻ چاتل پرماتما به ظاهر تي پوندو آهي، چاتل ٿي پوندو آهي. "پاو بسيه ڀڳوان، سکم ندان ڪروڻا ڀون" (رام چرت مانس ٩٢-٧) شري ڪرشن ان کي شردا ڪري ڪوئيو آهي. پاو ۾ اهو بل آهي جو ڀڳوان کي وس ۾ ڪري ڇڏيندو آهي. پاو سان ئي سڀني پچ مئي پرورتئن جو وڪاس آهي. هو پچ جو سنپاليندڙ آهي. اهڙو بلوان آهي جو پرم ديو پرماتما کي ممکن بٿائيندو آهي، پر آن جو ساث اهڙو ڪومل به آهي تم اچ پاو آهي. سڀائي اپاو ۾ بدلاجڻ ۾ دير نشي لڳي. اچ توھين چئو ٿا تم مهاراج ڏadio سنو آهي. سڀائي چئي سگهو ٿا آهي. پرم روپي پيشم جيڪڏهن سوپارو ٿئي ٿو، تم پرڪريء جي

جنهن دپ ۾ توهين آهيون ان کان به وڌيڪ دپ جي گھييري ۽ توهان کي ٻڌي چڏيندو. دپ جو هڪڙو تهه بيو وڌي ويندو، دپ جو گھيرو گھاتو ٿيندو ويندو. هيءَ پِرَمَ ان کان سواءِ بيو ڪجهه نه ڏيئي سگهندو. هاڻي پركرتي کان نورتني ئي چوتڪاري جو مارگ آهي. سنسار ۾ پرورتي جو پيانڪ گھور انڌكار جي چايا آهي. ان جي اڳيان ڪوروون جي ڪابه گ هوشٰطا ڪونهي. ڪوروون طرفان ڪيتائي باجا هڪ ساث وڳا، پر ڏسجي ته سڀ ملائي اهي به دپ ئي ڏئي ٿو، ان کان وڌيڪ ڪجهه به نه. هرڪو وڪار ڪو نه ڪو الڪو، دپ ڏئي ئي ٿو، تنهنکري هن به گھوشٰطا ڪئي، اعلان ڪيو ته:

تات: شُعْلَاشَ بَرْيَشَ پَنْوَانَكَغَامُخَا: ।

ساهسٰءاً بَحْرَهُنْيَنْ سَهَبَسْتُمُولَهُمَّاَهَ

تنهن شنکا شِجَّ پِيرِيشَجَّ پاٹوانِڪَ گومڪا هم سَهَسَ ئِي واپِيَهِنِيَنَت سَهِيدِسَهُمُلو ڀَوَت (۱۲) تنهن کان پوءِ انيڪ شنک، نغارا، يول ۽ نرسنهناد باجا هڪ ئي وقت وڳا. انهن جو آواز به ڏايو پيانڪ ٿيو. دپ جي جنبش ڦهاڻي کان سواءِ ڪوروون جي ڪا گھوشٰطا ڪونه آهي. باهرين وجاتي پرورتي سقل ٿي موه جو بندن اجا به گھرو ڪري ٿي چڏي. هاڻي پٽيمئي پرورتین طرفان اعلان ٿيا جنهن ۾ پهرين پدرائي يو گيشور شري ڪرشن جي هئي:

تات: شُرْتَهْيَرْيُوكَهْ مَهْتِي سَهَنْدَنَهْ سَهَنْدَنَهْ

ماڏوار: پاڻڊوارشِيَه دِبَّيَه شُعْلَاشَ پَرَدَمَتُه: ۱۱۹۴ ।

تنهن شويٽئير هيئي پرٽكتي مهتي سوندندي إِسِتِنَتُهُ ماڏوهه پاندو شچئيو دِويئُو شِنِڪئُو پِرَدَهَمَهَه (۱۳) تنهن کان پوءِ اچن گھوڙن سان گڏ (جنهن ۾ ذرو به ڪاراڻ جو دوش ڪونهي - اچا ساتوڪ، نرماتا جو لڳڻ آهي، نشان آهي)

”مهتي سوندي“ مهان رت تي وينل يوگيشور شري ڪرشٽ ئارجن به الوك شنکه وجایا. الوك جو ارت آهي، عامر لوکن کان پري مرتيو لوک، ديو لوک، برهم لوک جيستائين جنم مرڻ جو ڀو آهي، انهن سيني لوکن کان پري پرلوک پرمارٿك استتي ڏارڻ ڪرڻ جي پدرائي يوگيشور شري ڪرشٽ ڪئي آهي. سون، چاندي يا ڪاث جو رُٺ نه، رُٺ الوك، ته پدرائي به الوك ئي آهي. لوکن کان پري صرف برهم ئي آهي، سدو ان هر سمرپڻ استاپت ڪرڻ جي پدرائي آهي. هو ڪيئن اهڙي استتي حاصل ڪندا؟

پاڻجنجنْ هشٽکشٽو دے ڦادٽنْ ڏانجنجا: ।
پاؤ ڏو دَدَمَهُ مهَاشِنَكِيرَ بِيمَكَرِماَ وِرِكُودَرَهَ ॥۱۵॥

پانچجنيه هريشي ڪيشو ديو دٽير ڏنڄجيمه پونڊيره دڏ مئُو مهاشِنَكِيرَ بِيمَكَرِماَ وِرِكُودَرَهَ (۱۵) ”هرشِيڪِيش“ جو هردي جو سڀ ڪجهه ڄاڻندڙ آهي، اُن شري ڪرشن پانچجنيه شنکه وجایو. پنج گيان اندرин کي پنج تَن ماتِرائون (شبڊ، سڀش، روپ، رس، گند) جي رسن کي گڏ ڪري پنهنجي جَن (پيڳت) جي قطار هر ڏيلٽ، وجهن جي گھوشٽا ڪئي. چنچل روپ هر بهڪڻ واريں اندرin کي گڏ ڪري اُنهن کي پنهنجي داس جي قطار هر بيهاڻ هرديه سان سچي ستگروء جي ڪرپا آهي، مهر آهي. شري ڪرشن هي يوگيشور ستگرو هو. ششٽيستو هِير - پيڳوان ! مان تو هانجو شش آهيان. باهرين وشين کي چڏي ڏيان هر إشت کان سوا نه پيو ڏسون، نه پيو ڪجهه بدؤون، نه پئي کي چھون، اهو ستگروء جي اشاري ڪرڻ تي مدار ٿو رکي.

”ديو دٽير ڏنڄجيمه“ دئوي سمپتي کي اذين ڪرڻ وارو

انوراگه ئى ارجن آهي. إِشت (پورن پرماتما) سان چاهه جنهن ھر چۈزۈ، ويراگە، گۈزە ئاڭزۇ ھاجى " گىد گىد گرانىيەن بەھ نىرا" رومانچ ھاجى، امنگە ھاجى. إِشت كانسواء ڪنهن بە بى وشىئە جو ٽكراء نە ٿئى، ان کي "انوراگه" پرېم ۽ شردا چئجى ٿو. جڏهن اھو سقل ٿئي ٿو، تە پرم ديو پرماتما ھر پرويش ڏيارىن واري دئوي سمپتىء تى اڌكار پراپت ڪري وندو آهي. ان جو بیو نالو ڏننجىبە به آهي. هڪترو ڏن تە باھرين سمپتى آهي، جنهن سان سرير کي پالط جي ويستا ٿيندي آهي. آتما سان ان جو ڪوئي سنبند ڪونھي. ان کان پري هميشه رھن واري آتمك سمپتى ئى نج سمپتى آهي. برھدار ئىك و اپنىشد ھر ياغىولك مئترىء کي اھو سماچها يو تە ڏن سان سمپن پر ٿويء کي سواميتيو سان بە أمر تتو حي پراپتى نتى ٿي سگھي. اُن جو اپاء فقط آتمك سمپتى آهي.

پیانک ڪرم واري پيم سين "پوندر" معني پريت نالي وارو مهاشنك وجایو. پاو ۾ ئي پريت رکي آهي هن، تنهنكري پيم "پوندر" پريت نالي شنك وجایو. پاو ڏايو بلوان آهي؛ پريت جي جنبش ۽ اتساھه جي ذريعي.

हरि व्यापक सर्वत्र समाना । प्रेम ते प्रगट होहिं मैं जाना ॥

(रामिचरितमानस, १/१८४/५)

अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।

नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥१६॥

”ھرِ ویاپک سروتِر سمانا پریم تی پرگت ہو ہین مئن جانا“
(رام چرت مانس، ۵-۱۸۴-۱)

"آنڌت وڃي راجا ڪنتي پُترو یڏ شِنر هم
نُڪل سهديو شچ سگهوشم ٽيپشنه ڪئو" (۱۶)

ڪنتي پُتر راجا يڏشِنَر آنَنَت وجيم شنك وجايو. ڪرتويه روبي گنتي ئه ڏرم روبي يڏشتري. ڏرم تي پکي ورتني رهندى تم ”آنَنَت وجيم“ - آنَنَت پرماتما هر استتي ڪرايندو ”يٽي إِستَر سَهَر يِدَشَنَر هَم“ پر ڪري پرش ڪيرٽريگ جي سنگهرش هر پکو رهندو آهي. مهان دك کان به پَرم هر نتو اچي تم هڪ ڏينهن جو آنَنَت آهي. جنهنجو انت ڪونه آهي، اُهو آهي پرم تَتو پرماتما، اُهو ان تي اسانکي سوب ڏياري ٿو.

نيم روبي نُڪل ”سنگهرش“ نالي شنك وجايو. جيئن جيئن نيم وڏندو، اشپ جو وناش ٿي ويندو، شپ ظاهر ٿيندو ويندو، پڏرو ٿيندو ويندو. ستسنگ روبي سهديو ”مُطَي پشپڪ“ نالي شنك وجايو. مهرشين هڪ سواس کي ڏاڍي املهه جي سنکيا ڏني آهي. ” هيِرا جئسي سواسان باتون هر بيٽي جايه“ (”بندو“) هڪ ستسنگ ته اُهو آهي، جو توهين ستپرشن جي واڻيءَ دواران ٻڌو ٿا؛ پر سچو يقارث ستسنگ اندريون آهي. شري ڪرشن انوسار آتما ئي ستيه آهي، سناتن آهي. چٽ کي سڀني طرفن کان چڪي آتما جي سنگت ڪرڻ لڳي، اهو ئي سچو ستسنگ آهي. هيءُ ستسنگ چنتن، ڏيان ئه سماڻي جي اپياس سان پرپور هوندو آهي. جيئن جيئن ستيه جي ميلاپ هر صورت ڙكندي ويندي، تيئن تيئن هڪ سواس تي ظابطو ملندو ويندو، من سودو اندريون کيٹ ٿينديون وينديون. جنهن ڏينهن پورو قبضو اچي ويندو، وَسْتُو پراپٽ ٿي ويندي. سنگيت سازن وانگر چٽ جو آتما جي سُر سان سُر ملائي سنگت ڪرڻ ئي ستسنگ آهي. براهمٽ ڪنور آهي پر شواس مُطَي (سواس روبي موتي) گل کان به ڪومل آهي. گل ته ڦُنڌ تي يا پچٽ تي ڪومائجي ويندو آهي، پر توهين بئي سواس تائين جيئري

રહેઠ જી કેરન્ટી નના ડીની સ્કેન્ન. લિકન સ્ટન્સન્ગ સ્કેલ તીખ સાન
હ્રહ્ક સોાસ જી રોક્ટ સાન પ્રેમ લક્ષીય જી પ્રાપ્તી ત્થી
ત્થી. એ કાન પોં પાંડુન જી કાબે પ્રદરાઈ કુને હેઠી, પ્ર હ્રહ્ક
સાડન - ક્જેમ ને ક્જેમ નરમલતા જી રાહે જી દોરી તેમ ક્રાઈ
ત્થો. એભિયાન ચ્યો ત્થો:

કાશ્યશ્ર પરમેષ્વાસ: શિખણ્ડી ચ મહારથ: |
ધૃષ્ટદ્યુમ્રો વિરાટશ્ર સાત્યકિશાપરાજિત: ૧૧૭૧૧

કાશીશીશ્વિજ પરમિશ્વાસ શકન્દી ચે મહારથે

દરશિક્ષિદ્યમનો વરાશીજ સાત્યકિશ્વચા પ્રાજ્ઞથે (૧૭)

કાયા રોબી કાશી પ્રશ જ્ઢેન સ્પિની ત્રફન કાન મન સાન ગ્રદ
અન્દરિન કી સ્મીટી કાયા હો તી ગ્રદ કરી ત્થો, તે "પરમિશ્વાસ"
પ્રેમ એશ્વર હો વાસ કર્ણ જો એકારી ત્થી ત્થો. પ્રેમ એશ હો
મળન રહેઠ તી પોત્ર કાયા તી કાશી આહી. કાયા, સ્રીર હો તી
પ્રેમ એશ્વર જો નોાસ આહી. "પરમિશ્વાસ" જો એર્થ સ્રીયિષ્ટ
દનશ વારો બે આહી. બલ્ક પ્રેમ એશ વાસ આહી. શકા, સોત્ર
(મતીન એન્ડ) ચોત્યો કી ચ્છુટ તી શકન્દી આહી. એ કલ્હે માઠ્હો
મતી જા વાર કટાઈ, લહેઈ તા ચ્છીન એ ચોત્યો જી નાલી તી ગ
લ્યી જો જ્યો લાહી તા ચ્છીન. બાહે બાર્ણ ચ્છ્યી તા ડીન, ત્થી વિઓ
સન્નિયાસ હેન જો. ને હ્રચિક્ત હો ચોત્યો તી લક્ષીય જો નશાન આહી,
જન્હેન કી તોહાનકી પાંઠ્યો આહી એ સોત્ર એ સન્સ્કારન જો જિસ્તાઈન
એભિયાન પરમિશ્વર કી પાંઠ્યો બાચી આહી, પોં સન્સ્કારન જો સલ્સ્લો લગ્બો
ત્થો રહી, તિસ્તાઈન તિયાગે ક્હેર્ઝો? સન્નિયાસ ક્હેર્ઝો? એજ તે હેન રાહે
તી હેલ્થ વારો રાહેગી આહી. જ્ઢેન જિકી પ્રાપ્ત કર્ણો આહી સો
પ્રાપ્ત તી વિધી, પોં પન્નિયાન લેલ સન્સ્કારન જી તન્દ, ડૂર કંટ્યુન્ટ
વિધી, એહ્રાયો એવસ્થા હો પ્રેમ બલ્ક શાન્ત તી ત્થો વિધી. તન્હન્કરી

شکندي ئي يَرَم روپي پيشر جو وناش ڪري ٿو. شکندي چنتن جي راه خاص قابلیت آهي، مهارتي آهي.

”درِشتِ دِيُومِن“ درد ۽ اچل من ان طرح ”ورات“ ڪُل ورات ايشور جي ليلا ڏسٽ جي قابلیت وغيره دئوي سِمپتي جا خاص گٽ آهن. ساتوکتا ئي سچي آهي. سٽيئه جو چنتن جي پرورتي معني سانوکتا جيڪڏهن بطي رهي ته ڪڏهن به گراوت اچي نه سگهندی. هن لڑائي ۾ هارائڻ نه ڏيندي.

دُوپداو دُوپدايَاش: سَرْفَش: پُرثِيفَيَاتَهِ ।

سَأَبْدَرْشَ مَهَابَاهُوهُ: شَفَعَانَدَمُ: پُرثِكَرْثَكُ ॥۱۸॥

”درُوپِدو درَئُوپِدييَاشِج سَرْوَسَنَهُ پِرِقِويَيَتَي سَئُوپِيدِرَشَج مَهَابَاهُوهُ، سَتِكَانِدَهُ پِرِلَكِيرَثَك (۱۸) وڏي اچل پد وارو دروپد ۽ ڏيان روپي دروپدي جا پنج پت ڪومل، موھيندڙ، نئزت وارا ۽ پكي ارادي وغيره سادن ۾ مهان سهايڪ مهارشي آهن ۽ وري وڏين بانهن وارو ايمنيو - انهن سڀني الڳ الڳ شنك وجايا-بانهن جو بل ڪاريء کيترا جو نشان آهي. جڏهن من ڊپ کان آجو هوندو آهي تم انجي پهچ تمام پري تائين هوندي آهي. هي راجن، انهن سڀني الڳ الڳ شنك وجايا. ڪجهه نه ڪجهه دوري سڀ طئه ڪرائين ٿا، انجو بالن ڪرڻ ضروري آهي، ان ڪري انهن جا نالا ڳطایا ويا. ان کان سوا ڪجهه دوري اهڙي به آهي، جا من ٻڌي کان پري آهي. پڳوان پاڻ ئي اسانجي انتهڪرڻ ۾ ڪرائيندو آهي. هتي اسانجي درستي بطيجي آتما سان ڪڙو ٿي ويندو آهي ۽ سامهون پاڻ ساکيات بيهي پنهنجي سڀاڻپ ڪرائي ڇڏيندو آهي.

سَغَشَوَهُ دَارَتَرَادَهُانَ: هَدَيَانِيَ وَدَارَهَتَ ।

نَبَشَهُ پُرثِيفَيَهُ: چَاعَهُ تُمُولَهُ وَنُونَادَيَنَ ॥۱۹॥

يٽارت گيتا : شريمد ڀڳود گيتا

س گهوشود ار ترا شترا ئام سردايانى ونياداريت
نڀيشچ پر ٿوپير چئيو تملو ويندونادين (۱۹)
ان گهور شبد، آواز آڪاش ۽ پرتوي کي آواز سان پرپور
ڪندي ڏرترا شتر-جي پتن جي هردي کي ڏاري ڦاڙي ڇڏيو.
سينا تم پاندون جي طرف کان به هئي پر هردا ڏريا ڏرترا شتر
جي پتن جا. حقiqet ۾ پانچجنies، دئوي شكتي مهان، اننت
تي سوپ ۽ اشپ جو وناش ۽ شپ جي پدرائي نمبروار ٿيڻ لڳي
تم ڪروكيت، راڪسي سمپتي، باهر مکي پرورتien وارن جا
هردا ٿلجي پوندا. انهن جو ٻل آهستي آهستي ڪيڻ ٿيڻ لڳي
ٿو. هر هند سسلتا ملن تي موھ مئي پرورتien هر طرح شانت
ٿي وينديون آهن.

अथ व्यवस्थिरान्दृष्ट्वा धार्तराष्ट्रान्कपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसम्पाते धनुरूद्यम्य पाण्डवः ॥२०॥

अर्जुन उवाच

हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ।
सेनयोरु भयोर्मध्ये रथं स्थापय मेऽन्ध्युत ॥२१॥

”آٿ وَيَوِسْتَانِدِرِيَتُوا ڏار ترا شِتِرا نَكَبِيَّةَ وَجَ
پِرَوِرِتِي شِسْتِرَ سَمِّيَّاتِي ڏَنْرِدِيَّمِيَّهَ پاندوهه (۲۰)
ارجن اوچ

هريشيكيشم تدا واڪبِمَدَماهَ مَهِيَّتِي
سينيورپيور مَدِيَي رَثِير سِتَّاپَيَهَ مِي چيٽ (۲۱)
سنیم روپی سنجیه اگیان سان ڊکیل من کي سمجھایو،
هي راجن! تنهن کان پوءِ ”ڪپيَّه وَج“ ويراڳه روپی هنومان.
ويراڳه ئي جنهنجو نشان آهي، جهندو آهي جنهنجو (جهندو
راشترا جو نشان مجيyo ويندو آهي). کي ماڻهو چوندا آهن -

ڌِوَجا (نشان) چنپِل هئي، تنهن ڪري اُن کي ڪپيٽِ وَج چيو ويو. پر نر، هتي ڪپي ساڏارڻ باندر نه پاڻ هنومان هو، جنهن مان اپمان کي ماري چڏيو هو ”سَمَّ مَانَ نِرَادِر آدِرمِين“ (مانس ۱۷-۱۳) قدرت جي ڏٺل پڏدل شين کان، وشين مان راگه جو تياڳه ئي ويراڳه آهي. (هاڻي ويراڳه ئي جنهنجو جنهندو آهي) ان ارجن ويosta روب سان ڏرتراشتير پتن کي بىنل ڏسي شستره لائڻ جي تياري ڪرڻ وقت ڏنس کطي ”هِر شِيكِيشِر“ هر هڪ هردي کي ڄاڻندڙ آهي، اُن يو گيشور ڪرشن کي هيء وچن چيا ”هي آچيت! (جو ڪڏهن به ڄاڻي نتو سگهجي) منهنجي رَت کي بنھي سينائن جي وچ ۾ بيهار“ هتي سارٿي، رت هلائيندڙ کي ڏنل حڪم ڪونه هو، ستگرو (اشت) کي ڪيل پارٿنا آهي - ڇا جي لاء بيهاريان؟

यावदेतान्निरीक्षेऽहं योद्दुकामानवस्थितान् ।

कैर्मया सह योद्धव्यमस्मिन्दणसमुद्घमे ॥२२॥

”يا وديتا نير يكشي ههِر يوڈ کامانو سٽتاناں
کر مئیبا سَھ بوييمس مِنرڻ سُمَد يمي (۲۲)
جيستائيں ماں هنن اسْتَتْ ٿيل يد جي ڪامناوارن کي
چگي ء طرح ڏسي نه ونان ته هن يد جي ميدان ۾ مونکي ڪنهن
ڪنهن سان يد ڪرڻي آهي؟

योत्स्यमानानवेश्रेऽहं य एतेऽत्र समागताः ।

धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥२३॥

”يوسِيمانا نويکشي هئير به ايتى تىز سماگتاهه
دار تراشتريسيه دُر بُتدير يُتدي پريچكير شوهه“ (٢٣)
دُر بُتدي دريودن جو يد هر ڪلياڻ چاهه وارا جي جي
راجا لوگه هن سينا ه آيا آهن. انهن يُت ڪرهه وارن کي مان

ડસન્ડસ, અન લાએ બિહારિયો. મોહે રોધી દ્રિયોદન. મોહે સાન પીરિલ
પ્રિયરનું જો કલીઅં ચાહેણ વારા જિકી રાજાઓનું હેન યેદ હી આયા
આહન, અન્હેન કી માન ડસાન.

સંજ્ઞય ઉવાચ

એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ् ॥૨૪॥

સંજ્ઞિહે ઓંજ

” એયોમક્તો હૃષીકેશો ગ્દાકીશીન પારત
સીનિયોર પીયોર મદી સ્તા પીટિઓ રથોત્તમ (૨૪)
ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીશ્રિતામ् ।

ઉવાચ પાર્થ પશ્યતાન્સમવેતાન્કુરુનિતિ ॥૨૫॥

” પીશેન્દ્રદ્રોઢ્યે મુક્તને સર્વોયશા હી જે મહીશ્રતાજ
ઓંજ પારત પ્રીણિતાન્સમોવિતા દ્કર્ષોનિતી “ (૨૫)

સંજ્ઞિહે ચ્છિય નંદ કી જિત્થ વારી એરજન દોવારાન હેન પ્રકાર
ચેટી ચ્છ્દ્ધ તી હ્રદિય જી જાણ્ઠ વારી શ્રી કર્શન બન્હી સીનાનેન
જી વજ હી પીશ્મ, દ્રોધ્યે “મહીકિષ્ટાજ્” શ્રીર રોધી પ્રથ્યો તી
એકાર જ્માઈન્ડી સીન્યિ રાજાની જી વજ હી અત્મ રથ કી બિહારી
ચ્છિય ત્રે-પારથ હેન ગ્દ ત્થિલ કુરોન કી ડસ્સો. હેની અત્મ રથ
સુન ચાન્દીએ જો રથ કુને આહી. સન્સાર હી અત્મ જો એરથ, વીજાર
ચાન્દીએ જો રથ કુને આહી. સન્સાર હી અત્મ જો એરથ, વીજાર
નાસોન્ત આહી. જો એસંજ્ઞિ આત્મા, એસંજ્ઞિ સુરૂપ જો સ્દાનીન
સાથ ડેટી, અહોવી અત્મ આહી? જન્હેન જી પન્નિયાન “અન્તમ” એષ્ટના
ને હાગ્યી.

તત્ત્રાપશ્યત્સ્થિતાન્પાર્થ: પિતૃનથપિતામહાન् ।

આચાર્યાન્માતુલાન્ભાતૃન્પુત્રાન્પૌત્રાન્સર્વોસ્તથા ॥૨૬॥

શ્વશુરાન્સુહૃદશૈવ સેનયોરુભયોરપિ ।

”تَنْرَا پِشِيَّتِسْتَنِيْپَارَتَكَهْ پِتِرِيَنَتَقِيْبَنَا مَهَانَ
آچَارِيَا نِمَا تَلَا نِيْرَا پِوَتِرَا نِسْكِيَنِسَاتَتَا (٢٦)
شِوَشِرَا نِسْهَرِدِيْشِكَعِيَوَ سِينِيُورُپِيُورَبِيِّ“

ان کان پوءِ جنهنجو نشان اچوک، مئل شریر کي رُث بٹائڻ
وارو پارت ٻنهي سيناين ۾ بيٺل پيءِ جي ڀائرن کي، پتامهن
کي، آچارين کي، مامن کي، ڀائرن کي، پُتن کي پوتون کي،
دوستن کي، سُھرن کي، گھڻگھرن کي ڏڻوبنهي سيناين ۾ ارجن
کي فقط پنهنجو پروار، ماما جو پروار، ساهرن جو پروار، گ
ھڻگhra ۽ گروجن ڏسڻ ۾ آيا. مهاپارت ڪال جي ڳڻپ مطابق
ارڙهن اکشوهطي لڳه ڀڳ چاليه لكن جي آس پاس ٿيندا آهن؛
پر هاڻوکي ڳڻپ انوسار ارڙهن اکشوهطي سادا چه ارب جي
لڳ ڀڳههه آهي، جو اجوکي سنسار جي جَن سنكيا جي برابر
آهي. ايترى وڏي ڪتك لاءِ جڏهن تڏهن سنساري طريقي رهڻ،
ڪائڻ جو وڏو مسئلو بطيجي ٿو پوي. هيترن گھڻن ماڻهن جو
ميڙ ارجن جي ڦن چئن پروارن جيترو هو. ڇا ايدو وڏو پروار به
ڪنهنجو ٿيندو آهي چا؟ ڪڏهن به نه هي دل جي ديش جو
چترن آهي - درشيه آهي.

تاٽسمीکشيم س ڪوٽييڪه سر وانبندو نوٽستان । ۱۲۷۱

ڪٽپا پاريا وشت وشيكند مبرٽويٽ ।

”تاٽسمٽكشيم س ڪوٽييڪه سر وانبندو نوٽستان (٢٧)
ڪِرِپِيا پِرِيا وِشِتو وِشِيكِنِدَ مِبِرَوِيٽ“
اهڙي طرح سڀني بيٺل ڀائرن کي ڏسي ڏاڍي ديا سان
پريل هو ڪُنتي ۽ جو پُٺ ارجن دکي ٿي چيو. ارجن کي ڏاڍو
شوک ٿيو چو جو هن ڏنو ته هي سڀ ته منهنجو پنهنجو پروار
ئي آهي - هاڻي چيائين

يٽارٽ گٽا : شرييمد ڀڳود گٽا

ارْجُنَ عَوَّاصَ

دُوْشِتَوَمَ سَوْجَنَمَ كَرْشَنَ يِئِيْتَسُونَ سَمْهَيِسَتَهَرَ ۱۲۸۱

سَيِّدَنَتِي مَمَ جَاتِرَانَ مَكَمَ جَ پَرَيِشَشِيتِي ۱

وِيَهَتْتَشَكَهَ شَرِيرِي مِي رَوَمَهِرِشَكَهَ جَايِتي ۱۲۹۱

ارْجُنَ أُواچَ

دِرِشِتُويِهَرَ سَوَّجَنَمَ كَرْشَنَ يِئِيْتَسُونَ سَمْهَيِسَتَهَرَ ۱۲۸۲

سَيِّدَنَتِي مَمَ جَاتِرَانَ مَكَمَ جَ پَرَيِشَشِيتِي ۱

وِيَهَتْتَشَكَهَ شَرِيرِي مِي رَوَمَهِرِشَكَهَ جَايِتي ۱۲۹۲

هي ڪرشن! يٽ جي چاهڻ واري بىنل هنن سڄڻن جي سڄي
ميڙ کي ڏسي منهنجا انگه ڪاندارجي رهيا آهن، زبان سکندي
ٿي وڃي، منهن به سُڪندو ٿو وڃي ئه منهنجي شرير ۾ ڏڪطي
ء آندماند ٿي رهي آهي. ايترو ئي نه -

گاڻديوں سڻساته هستا تڪڻيئه پاريداھتے ।

نَ�َ شَكْنَوَ مِيَوَسَتَأَتِيرَ پِرَمَتِيَوَ چَ مِيَ مَنَهَ ۱۳۰۱

”گانڊيوه سَرَفَسَتِيَ هَسَنَاتِتَهَ ڪَچَئِيَوَ پِرِيدَهِيَتِي

نَهَ چَ شَكْنَوَ مِيَوَسَتَأَتِيرَ پِرَمَتِيَوَ چَ مِيَ مَنَهَ ۱۳۰۲

هٽ مان گانڊيوه ڏنس ٿو ڪري، چمزٽي به سڙي رهی آهي.
ارجن کي چڻ بخار اچي ويو، گرم ٿي ويو ته هي ئه ڪھڙي
يٽ آهي، جنهن ۾ پنهنجا سڄڻ ئي بینا آهن. ارجن کي
پِرَمَتِيَوَ هو چوي ٿو - موون ۾ هاڻي بيھڻ جي طاقت نه
رهي آهي، هاڻي اڳيان ڏسٽ جو موون ۾ بل ڪونهي.

نِيمِتَانِيَ چَ پَشَيَامِيَ وِيَرِيتَانِيَ ڪِيشَوَ

نَهَ چَ شِريَيُونَ پِشَيَامِيَ هَتِواَ سَوَجَنَمَاَهُوَ ۱۳۱۱

”نِيمِتَانِيَ چَ پِشَيَامِيَ وِيَرِيتَانِيَ ڪِيشَوَ

نَهَ چَ شِريَيُونَ پِشَيَامِيَ هَتِواَ سَوَجَنَمَاَهُوَ ۱۳۱۲

هي ڪيشهو! هن يد جا آثار به اُبنا ئي ڏسان ٿو. يد ڦر پنهنجي ڪل کي مارڻ ۾ پنهنجو ڀلو به نتو ڏسان، پرم ڪلياڻ به نتو ڏسان. ڪل کي مارڻ سان ڪھڙو ڪلياڻ ٿيندو؟

न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सखानि च ।

किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥३२॥

”نه ڪانگِشي وڃيئر ڪرشٽ نه چ راچيئر سکاني چ
ڪير نو راجيئين گووند ڪير ڀو گئير جيوٽين و(۳۲)
سچو پروار يٽ جي لاءِ موت جي مڻههن ۾ آهي. انهن کي يٽ
۾ جيت، سوب. سوب کان ملٽ وارو راج ۽ راج کان ملٽ وارو سُك
ارجن کي نه کپي. هو چوي تو - ڪرشٽ! مان پنهنجي جيت
نتو چاهيان گووند! اسانکي راج يا جيون سان ڪھڙو پريوچن
آهي؟ چو؟ ان تي چوي ٿو
يَهَا مَثْرِئَ كَادِلِيَّتَ نَوْ رَاجْيَنْ بَوْهَجَا: مَخْنَنِيْ چ |

न इमेऽवस्थिता यद्दे प्राणांस्त्यत्त्वा धनानि च ॥३३॥

”یشا مرِ شی کانگِ شتیر نو راجیئر یوگا ها سُکانی چ
ته امی وسِتتا یُدی پراٹائِستَنِتْوا ڈناني چ (۳۲)
اسانکی جِن لاءِ راج، یوگے ئ سُک وغیره جي چاهنا آهي.
اُھوئی پروار جیئن جي آشا تیا گی يد جي میدان چ بینا
آهن. اسان کی راج جي اچا هئی ته پروار سان گڏ، یوگے،
سُک ئ ڏن جي لالچ هئی، ته سچُن ئ پروار سان گڏ اُنهن کی
یوگن جي هئی، پر جڏهن سڀ جا سڀ پراڻن جي آشا تیا گی
بینا آهن، ته مونکی سُک، راج یا یوگے نه کپن. اهي سڀ هنن
جي ڪري پيارا هئا. هنن کان جدا ٿيئ تي اسانکی انهن جي
گهرج ڪونهي. جيستائين پروار رهندو، تيستائين اهي واسنائون
به آهن. جھوپڑي چ رهڻ وارا به پنهنجي پروار، متر ئ سچُن

کي ماري سچي سنسار جو راج به سوبڪار ڪونه ڪندا. ارجن به
ائين ئي ٿو چوي ته اسان کي پيوگه پيارا هئا، سوي پياري
ھئي، پر جن لاءِ ھئي، جڏهن اُھي ئي نه رهندما ته پيوگن سان
ڪھڙو واسطو؟ هن يڌ ۾ مارڻو ڪنهن کي آهي؟
آچار્યા: પિતર: પુત્રાસ્તથૈવ ચ પિતામહ: ।

માતુલા: શ્વશુરા: પૌત્રા: શ્યાલા: સમ્બન્ધિનસ્તથા ॥૩૪॥

”آچارિયા, પટેરા પટેરા સ્તોત્રીયોજ પ્તામહાહ
માતા શ્વોશ્રાહ, પાઈઓટ્રાહ શિલાલાહ સેમિન્ડિન્સિસ્તા“ (૩૪)
هن يڌ ۾ આચારિય, તાર્દુ, ચાચા, પુત્ર આ હેર્ઝી પરકાર
ડાડા, મામા, સુહરા, પૂત્રા, સાલા આ પ્રિયા સેન્બિન્ડી તી આહે.
એતાન્ન હન્તુમિચ્છામિ ઘોડપિ મધુસૂદન ।

અધિક્રતીય હેતો: શિં નુ મહીકૃતે ॥૩૫॥

”એયાનને તુમ્હામિ ગહેનો પ્રી મદસુદન

આપી તરલોકિબ્રા જીવિસીમે હીતોહે ક્રિ નુ મહીકરિતી (૩૫)
હી મદસુદન! મુનકી માર્દ તી બે યા તન્હી લોકન જિ
રાજ જી લાએ બે માન હનન સ્વીણી કી માર્દ ન્તો ચાહીયાન, પોણ
પરથોયે લાએ ચોઠ્ઠો તી ચા આહી؟

એર્જન એકોહેઠીયી સીના ۾ એરજન કી પનહનગ્રો પ્રોવાર તી
ડસ્ટેન્સ ۾ આયો. એટ્રા ગ્રહેતા સ્જેટ આ માઇટ હ્રિક્વિચ્યુન્ટ ۾ ચા આહી?
સ્જે તે મોહે તી એરજન આહી. પ્રેર્જન જી શ્રોઉન્ટ ۾ હ્રહ્ક એન્જરા
ય (મોહે વારો) જી સામહોન એહાઈ મશ્કલાત રહ્યી આહી. સ્પિય
ચાહીન તા એસિન પ્રેર્જન ક્રિયાનું આ પ્રેર્મ સ્ટીલ કી પાયાયો, પર કન્હન
એન્યોયી સ્ટેગર્રો જી શ્રેન ۾ ક્રોચી એન્જરાગી (મોહે વારો) જીદું
ક્રિટર, ક્રિટર ગીધ જી સન્ગહેરશ કી સ્માજહી તો તે એસાની કન્હન
સાન લર્ણું આહી, તે હો નામીદ તી તો વ્યાખ્યા. હો ચાહી તો તે એસાન
જી પ્રતા જો પ્રોવાર, સાહેરન જો પ્રોવાર, મામા જો પ્રોવાર, સ્જેટ,

دوسٽ ئه گرو گڏ ئي هجڪن مونسان، سڀ سکي رهن ئه انهن سڀني جي وبوستا (بندوبست) ڪندي اسيين پرماتما سوروپ کي پراپت ڪريون. پر جڏهن هو سماجههي ٿو ته آراڏنا هر ڏيان لڳائڻ لاءِ پروار کي چڏڻو پوندو، انهن رشتئ ناتئ جو موھ سماپت ڪرڻو پوندو، ته هو بي چئن، بي آرام ٿو ٿئي، ڏيرج وجائي ٿو وهي.

پوجيه معراج جي چوندا هئا، ”مرڻ ئه سادو ٿيڻ برابر آهي.“ سادوء لاءِ سرشيء هر ڪو جيئرو به آهي، پر گهر پريوار جي نالي ڪوبه. جيڪڏهن ڪير آهي، ته اُن سان لڳاءِ آهي، موھ سماپت ڪتي ٿيو آهي؟ جيستائين سنبند آهي، اُن سنبند جي هستيء سودو منجڻ تي به اُن جي سوب آهي. انهن سنبندن جو ڦھلاء ئي ته جڳت آهي، نه ته ان کانسواءِ جڳت هر اجايو چا آهي؟ ”تسيداس ڪنه چِد ولاس جَگ، بُوجهت بُوجهت بُوجهت“ ونيمه پترڪا ، ۱۲۴

‘تُلسمی کہ چِدِ وِلاسِ جَگ، بُو جھت بُو جھت بُو جھتی’

(વિનય પત્રિકા ૧૨૪)

هن جو ڦھلاء ئي جڳت آهي. يو گيشور ڪرشن به من جي ڦھلاء کي ئي جڳت چئي اسان کي ٻڌايو آهي. جنهن هن جي اثر کي روکيو آهي، تنهن سڄي چرنڌڙ اٺ چرنڌڙ جڳت کي جيتيو آهي.

ઇହେવ تَرْجِيمَة: سَارْغَانْ يَهَشَانْ سَامَعَهُ سَمِيتَهُ مَنَهُ । (गीता, ५ - १९)

فقط ارجن ئي اڌير هو، اهڙي ڳالهه ڪونهي. پيار ئه موھ سڀني جو آهي. هرڪو پيار ئه موھ وارو اڌير ٿيندو آهي، ڏيرج وجائي وھندو آهي، هن کي سنبندئي ياد اچڻ لڳندا آهن. پھرین

هو سوچيندو هو ته ڀڳن ڪرڻ سان ڪجهه لاي حاصل ٿيندو، ته هي سڀ سکي ٿيندا. اُنهن سان رهي انهن کي ماڻيندسا. جڏهن هو گڏ ئي نه رهندار، ته سکه وئي چا ڪندس؟ ارجن جي درشتري راج جو سکر، منزل ٿي سماجي. هن کان وڌيڪ به ڪو سٽيه آهي. ان جي ڄاڻ ارجن کي اجا ڪانه آهي.

نِھٗتٗيَمْ دَارِ تِرا شِتْرَا نَھَمْ كَأْ پَرِبَتْھَمْ سَوَاجَنَارَدَنْ ।

پَاپَمَهَوَا شِرَيِي دِسَمَانْ هَتِيَيِي تَانَا تَتَائِيَنَهِ ॥ ۳۶ ॥

”نِھٗتٗيَمْ دَارِ تِرا شِتْرَا نَھَمْ کا پَرِبَتْھَمْ سَوَاجَنَارَدَنْ پَاپَمَهَوَا شِرَيِي دِسَمَانْ هَتِيَيِي تَانَا تَتَائِيَنَهِ“ (۳۶)
هي جناردن! ڏرتراشتري جي پتن کي ماري اسانکي ڪھڙي خوشی ٿيندي؟ جتي ڏرتراشتري معني ڏرشنـتا جو راج آهي، جتي همت واري ڪـزـي تـزـي جـو رـاشـتـرـ آـهـيـ، هـنـ مـاـنـ پـيـداـ ٿـيلـ موـهـ روـپـيـ درـيوـدنـ وـغـيرـهـ کـيـ مـارـيـ بـهـ اـسانـکـيـ ڪـھـڙـيـ پـرسـنـتـاـ ٿـينـديـ.
هـنـنـ ظـالـمـنـ هـڪـارـنـ کـيـ مـارـيـ اـسانـ کـيـ پـاـپـ ئـيـ تـهـ لـڳـنـدوـ.
جيـڪـيـ پـنـھـنجـيـ جـيـ جـيـ ٿـجـ جـيـ لـاءـ اـنـيـتـيـ ٿـاـ اـپـنـائـينـ، اـهيـ
ظـالـمـ ئـيـ چـوـائـينـداـ آـهـنـ، پـرـ حـقـيقـتـ اـنـهـنـ کـاـنـ وـڏـوـ هـڪـارـوـ،
ظـالـمـ اـهـوـ آـهـيـ، جـوـ آـتـمـڪـ رـاهـ لـاءـ رـڪـاوـتـ ٿـوـ پـيـداـ ڪـريـ.
آـتـمـ درـشـنـ جـوـ وـرـوـڊـيـ کـاـمـ ڪـرـوـدـ، لوـڀـ موـهـ وـغـيرـهـ سـڀـنيـ
وـڪـارـنـ سـانـ پـيرـيلـ ظـالـمـ آـهـيـ.

تَسَمَّا نَارِهَا وَيَمْ هَنْتُوْ دَارِ تِرا شِتْرَا نِسْوَوْ بَانِدِوْا نْ ।

سَوَاجَنَمْ هِيْ ڪُتْمِرْ هَتِوَا سُكِينَهِ سِيَامْ مَادَوْ ॥ ۳۷ ॥

ان سان هي مادـوـاـ اـپـنـيـ رـشـتـيدـارـنـ ڏـسـتـراـشتـريـ جـيـ پـتنـ مـارـڻـ
جيـ لـاءـ اـسـيـنـ لـائـقـ نـهـ آـهـيـونـ، اـسانـ کـيـ اـهـوـ نـتوـ ٺـهـيـ، نـتوـ وـڻـيـ،

پنهنجا سنپندى ڪھڙا! هو ته شترو هئا نا! سچ ته شرير جا رشتا اگيان مان پيدا ٿين ٿا، هي ماما آهن، سسرال ۽ سڄن ساتي آهن، اهو سچو اگيان ئي ته آهي. جڏهن شرير ئي ناسونت آهي، تڏهن اُن جا رشتا ئي ڪتي رهند؟ موهر آهي تيستائين سڀ پيارا آهن، اسانجو ڪتب آهي، اسانجي دنيا آهي موهر ناهي ته ڪجهه ٻي ناهي. تنهنڪري ارجن کي دشمن به ڏيكاري ڏيڻ لڳا. هو چوي ٿو پنهنجي ڪتب کي ماري اسین ڪيئن سکي ٿيندا سين. جي اگيان ۽ موهر نه هجي ته ڪتب جي ڪا هستي نه هجي، ڪو وجود نه هجي. هيء اگيان گيان جي راهه ڏيكاريندڙ به آهي، پرتري، تلسي وغيره انيڪ مها انپوين ويراڳه جي رُچي، جوش پتنيء مان مليو، ته ڪو ماتيجي ماڻ جي وهنوار کان بيزار ٿي ويراڳه جي راهه ڏانهن مائل ٿيندو ڏسط ۾ آيو.

યદ્યાપ્તે ન પશ્યન્તિ લોભોપહત્યેતસઃ ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ् ॥૩૮॥

”يَدِيَّبِيَّتِيْ نَمَّ پَشِيَّنِتِيْ لَوِيُّوْ پَهَتِچِيَّتَسَهَمَ
كُلَّكِشِيَّكِرَتَمَ دُوْشِرِ مِتَزِدِرُوْهَ ٰ پَاٰتَكِيرَ (٣٨)
جيڪڏهن لوڀ ۾ پرشت چت ٿيڻ سبب هي لوڪ ڪل جو
ناس ٿيڻ جي دوش ۽ مترن سان دوهه ڪرڻ جي پاپ کي نتا
ڏسن، اها اُنھن جي گھتنائي آهي پوءِ به -
કथَنِ نَ جَيَّيَمَسَمَابِحِ: پَآپَادَسَمَانَبِرِتِتُمَ ।

કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્વિર્જનાર્દન ॥૩૯॥

”كَتَّيْرَ نَمَّ گَيِّيَيِسِسَمَأَيِيَهَمَ پَآپَا دَسِمَا فَنَوْرَتَ تُمَ
كُلَّشِيَّكِرَتَمَ دُوْشِرِ پَرَپِشِيدِ پَدِرِجَنَارِدَنَ (٣٩)

هي جناردن ! ڪُل ناس ٿيڻ وارن دوشن کي چاڻڻ وارا اسيين ماڻهو هن پاپ کي هتائڻ لاء ڇو نه ٿا ويچار ڪرڻ چاهيون؟ مان ئي پاپ ٿو ڪريان، اها ڳالهه ڪونه آهي - توهين به چوڪ ڪرڻ وڃي رهيا آهي. شري ڪرشن تي به ڏوھه مڙھيائين هيئر هو پاڻ کي شري ڪرشن کان گھت ڪونه ٿو سمجھي. هر هڪ نئون سادڪ ستگروءَ جي شرن وٺڻ تي ان پرڪار تِرڪُتِرڪ ڪندو آهي ئ پاڻ کي چاڻ ۾، گيان ۽ گھت نتو سمجھي. ارجن به اھوئي چئي رهيو آهي. ارجن به ائين ٿو چوي ته هو پالي نه سمجھن پر اسيين ئ توهين ته سمجھدار آهيون. ڪل ناش جي دوشن تي اسان کي ويچار ڪرڻ گهرجي. ڪُم ناس ٿيڻ ۽ ڪھڙا دوش آهن؟

کُلکشِي پرِ ڦشينتِي ڪُل ڏرمها سناتنا: |
�र्म ناش کُل ڪوتُسْنَمَدَرِ رمو پِيَوْتِيَّت ॥٤٠॥

”کُلکشِي پرِ ڦشينتِي ڪُل ڏرمها سناتناها ڏرمي ڏشتني ڪُل ڏرم ڪِرسِنَمَدَرِ رمو پِيَوْتِيَّت (٤٠) ڪُل جي ناس ٿيڻ سان سناتن ڪُل ڏرم ناس ٿي ويندو آهي. ارجن ڪُل ڏرم، ڪُل جي آچار وهنوار کي ئي سناتن سمجھي رهيو آهي. ڏرم جي ناس ٿيڻ تي سڄي ڪُل کي پاپ به ڏاڍو دٻائي ٿو چڏي.

اَدَرْمَآبِيَّيِ پِوَاٽِكِرْشَنِ پِرِ دُشِينتِي ڪُلِسِتِرِ يَهَهِ
سِتِرِ يَشُو دُشِتَاسُو وَاشِتِيَّيَهِ جَائِنَيِ وَرَكِسِنَكَرَهَهِ ॥٤١॥

هي ڪرشن! پاپ جي گھطي وڌڻ تي ڪُل جون استريون پليت،

اپورت ٿين ٿيون. هي واشريٽيئه ! استريين جي اپورت ٿيڻ سان گاڏڙ
 ۽ کريل ٻار پئدا ٿين ٿا. ارجن جو خيال هو، هن ائين ٿي ميکيو ته
 استريين جي پليٽ ۽ اپورت ٿيڻ سان کريل ۽ گاڏڙ ٻار پيدا ٿيندا،
 پر شري ڪرشن ان ڳالهه کي نٺو مجي، انڪار ڪندڻي وڌيڪ چيو
 ته مان يا سوروب ۾ لين ٿيل مهاپرشن جي آرادنا ڪرم ۾ پرم
 اٿپن ڪري ٿو تڏهن ورڻسنڪر ٿيندو آهي، ورڻسنڪر جي دوشن
 تي ارجن پرڪاش ٿو وجھي ۽ بڌائي ٿو.

सङ्करो नरकायैव कुलधनानां कुलस्य च ।
पतन्ति पितरो ह्येषां लुभपिण्डोदकक्रिया ॥४२॥

”سِنکرو نَر کا یئیو ڪلگھنا نام ڪلسيٰ جے ا
پٽنڌتی پٽترو هٗبیشا ۾ لُپٽپنڊو دک ڪرياهه ۱۱ (۱۴۲)
ورٽ سنکر کريل ٻار ڪل جي ناس ڪرڻ وارن ئے ڪل کي
نر ڪ ۽ وٺي وجٽ لاء ٿين ٿا. گم ٿيل پند ڪري وارا انهن جا
پٽر لوگه به ڪري پون ٿا. ورتمان اچ نشت ٿي ويندو آهي،
ما ضيء جا پٽر ڪري پوندا آهن ئے ڀویشی، مستقبل وارا به
کرندا . ايترو ئي نه.
دोষرئت: کولڻانام ڦارڪ:

उत्साद्यन्ते जातिधर्माः कुलधर्मश्च शाश्वताः ॥४३॥

”دوشیریتکیه کلگهنا نام ور ظسنکر کار کئیهه
اُتسادیئنتی جاتیدرماه کلدر ماشچه شاشوت تاها ۱۰ (۱۴۳)
ان ور ظسنکر کارک دوشن سان کل ئ کل گهاتین جو سناتن
کل ڈرم ئ جاتي ڈرم به ناس ئي ويندا آهن. ارجن مجي ٿو ته
کل ڈرم سناتن آهي، کل ڈرم ئي نُت سدا قائم آهي. پر
شری ڪرشن انجو وروڏ ڪيو ئ وڌيڪ بڌايو ته آتما ئي سناتن
آهي، نُت سدا رهڻ وارو ڈرم آهي، حقیقت ڻ سناتن ڈرم

કી જાણે કાન ઓલ મનુષ ડરમ હી નાલી હું કન્હેન ને કન્હેન
પરમ્પરા ઓચાઈ, શાન કી જાણી તો. ઠીક એહ્યી ત્રણ એરજન બે
જાણી તો, જીકો શરી ક્રશન હી શબ્દન હું હું પરમ્પરા આહી.

ઉત્સવ્નિકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।

નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રૂમ ॥૪૪॥

”આંત્રણ કુલ્દરમાણ મનુષ્યાણ હું જનાર્દન
નરકી નીટિર વાસો પ્રોત્સિદ્ધીનુશુશ્રૂમ (૧૪)

હી જનાર્દન! નાસ તીલ કુલ ડરમ વારન મનુષ જો એન્ટ કાલ
તાઈન નરક હું વાસ તીનદો આહી, એચિન મુન બ્દો આહી. ફેલ કુલ
ડરમ તી ન્તો નાસ તીની. બલ્ક દાયી કાયી ન્તું સન્તાન ડરમ બે
નશ્ટ તી વિનદો આહી. જરૂર તી નાસ તી વિઓ તે એહ્રા
પ્રશ તે એન્ટ કાલ તાઈન નરક હું ન્યાસ કંદા આહી, એચિન
મુન બ્દો આહી. ઢનો કુન્હેચી, બ્દો આહી.

અહો બત મહત્પાપં કર્તૃ વ્યવસિતા વયમ् ।

યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતા: ॥૪૫॥

”આ હો બેટ મહેત્પાપ કર્તૃર વિયોસ્તા વીયર
યેદ્રાજીયુસ્કમ લોપીન હેન્તુર સ્વોજન્મુદ્યતાહ “ (૧૫)

એર્યી! ઢાકે આહી તે એસીન સ્યાણ તી બે હી ગ્હેર પાપ
કરું લાએ ત્યાર ત્યા આહ્યોન. રાજ એ સ્ક જી લોપ હું પનહંગ્યિ
કુલ કી મારું લાએ અંસ્ક ત્યાં તા.

હાણી એરજન પાણ કી ગેઠ સ્યાણ ન્તો સ્મજ્ઝી. શરૂએ હું
હેર કો સાડે એચિન તી ચુંદો આહી. મહાત્મા બ્દે જો ચુણ આહી
તે મનુષ જરૂર એરજન એરજન એરજન એરજન એરજન એરજન
યાણી સ્મજ્ઝન્દો આહી એરજન એરજન એરજન એરજન એરજન
કરું લેંનદો આહી તે પાણ કી ગ્યાણી તો સ્મજ્ઝી. હો શરી
ક્રશન કી તી સ્મજ્ઝહાયી તો તે હેન પાપ માન મ્હા કલ્યાણ

ٿئي. اهڙي ڳالهه به ڪونهي، فقط راج ئ سکه جي لوپ کي پڪڙي اسيين ڪُل ناس ڪرڻ لاءِ اُتسڪ ٿيا آهيون. خطرناڪ ڀُل ٿا ڪريون. اسيين ئي ڀُل ڪري رهيا آهيون اهڙي ڳالهه ڪونهي توهين به ڀُل ڪري رهيا آهيو. هڪ جهٽڪو شري ڪرشن کي به ڏنائين-پچاڙي ۽ پنهنجو فيصلو ٿو ڏئي
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपातीयक्षम
धार्तराष्ट्र रणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् ॥४६॥

”يَدِي مَامِپْرَتِيَّكَارَمَشِسْتَرَمْ شَسْتَرَپَاَتِيَّكَهْ
ذَارِتَر؛ شِتَرَا رَظِيَّهْ كَهْنِيَّسْتَنِيَّهْ كِيمَتَرَمْ ڀَويَتْ (۱۴۶)
جيڪڏهن مونکي بنا هٿيار مقابلو نه ڪرڻ واري
شسترهاري ڏرتراشترا جا پت رظن ڀوميءَ ۽ ماري، ته اُنهن
جو اُهو مارڻ منهنجي لاءِ ڪلياڻڪاري ٿيندو. اتهاس ته چوندو
ته ارجن سمجھدار هو، جنهن پنهنجي قرباني ڏيئي يڌ جو بچاءُ
ڪيو. لوڪ پنهنجي پرائڻ جي آهوتي ڏيئي ڇڏيندا آهن ته بالا
ڀولا معصوم ٻار سکي رهن، ڪُل ته بچيل رهي. ماڻهو پرديس ويو،
عيش عشرت ۽ رهيا، مڪلاتن ۽ رهيا، پر بن ڏينهن کان پوءِ کيس
پنهنجي ڇڏيل جھوپڙي ياد اچھ ٿي لڳي. موھه ايترو پربل آهي.
ان ڪري ارجن چوي ٿو ته هٿيارن واري ڏرتراشترا جا پت
جيڪر ڪنهن وار نه ڪرڻ واري کي رظن ڀوميءَ ۽ ماري چڏين،
تڏهن به اهو منهنجي لاءِ ڏاڍو ڪلياڻڪاري، سڪدائڪ ٿيندو جيئن
چوڪرا ته سکي رهن.

سنجيئ ઉવાચ

एवमुत्तवा-वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् ।
विसृज्य सशरं चापं शोकसंविग्रहमानसः ॥४७॥

سننجيئ اوُاج
”ايو مِكتوا ارجن سَنِكِبِي رَّثْوَپِسَتْ آپَاوَشِت

وِسِرِ جِير سَشَرَه چَاهِير شوَكَسِمُونَه ما نَسَكَه (٤٧)
 سندجيه چيو ته رن پومي ۽ شوك ۾ بدل من واري
 ارجن ان طرح چئي، باط ساط ذنش کي چڏي رت جي
 پنهين پاسي ويهي رهيو مطلب ته کيترا، کيترا گيه جي لڙائي ۽
 ۽ پاڳه وٺڻ کان پنيان هتي ويyo.

قاقيچه

گيتا کيترا - کيترا گيه جي ڀڏ جو فيصلو آهي، تُ آهي.
 هيء ايشوري مهمما سان پورن يڳوت سروپ ڏيكارڻ وارو گ
 بيت آهي. هيء گيت جنهن کيترا ۽ تئي ٿو، هيء ڀڏ
 کيترا شرير آهي. جنهن ۽ به پرورتیون آهن. ڏرم کيترا،
 ڪڙو کيترا. هنن سئنان جو سروپ ۽ اُنهن جو بل سروپ ۽
 انهن جي بل جو آدار ٻڌابو، شنكه ذنيه سان اُنهن جي
 پراكرم جي چاڻ ملي. تنهن کان پوءِ جنهن سينا سان
 لڙڻو آهي، انجي جاچ پڙتال ٿي. جنهن جي ڳلپ ارڙهن
 اکشوهڻي (لڳ يڳ چھه ارب) چئي وجي ٿي، پر حقیقت
 ۽ هو انت آهن. قدرت جا نظر يا به آهن. هڪ اشتونمکي
 پرورت ٿي "ڊئوي سمپتي". بي باهرمکي پرورت ٿي "آسورى
 سمپد" به ئي قدرت ٿي آهن. هڪ پنهنجي اشت ديو ڏانهن
 رخ ٿي رکي، پرم ڏرم پرماتما جي طرف ڏانهن ٿي وئي
 وجي ۽ بي پرڪرت ٿي ۽ وشواس ٿي ڏياري. پهرين ڊئويه
 سمپد کي سادي، سنواري "آسورى سمپد" جو انت ڪيو
 ويندو آهي، پوءِ پوتر سناتن پر برهم جي جاچ پڙتال ۽ اُن
 ۽ استتري سان گڏ ڊئوي سمپد جي ضرورت باقي رهي ٿي،
 ڀڏ جي ٿل جي اچا نكري ٿي وجي.
 ارجن کي سينا جي جاچ ڪندي پنهنجو پريوار ئي

ڏسڀ ۾ آيو آهي، چن کي مرڻو آهي. جيٽرو حيسٽائين سنبند آهي، اوترو ئي جڳت آهي. موهره ئ پيار جي پھرئين ڏاکي تي ڪتب جو موهره ئي رکاوٽ بٽجي ٿو. ساڌڪ چڏهن ڏسي ٿو تم مذر سنبندن ۾ اهڙي ڪزواهٽ ٿي ويندي، جيئن هو هئا ئي ڪونه، تم اُن کي گھبراهٽ ٿيڻي لڳي. متن ماڻن ئ سڄلن کي مارڻ ۾ اُنكى اشپ ٿو لڳي اڪلياڻكاري ٿو ڀاسي. هو هاڻوکين هلنڊڙ رسمن ۾ پرمپرائين ۾ پنهنجو بچاء ٿو ڳولٽ لڳي، جيئن ارجن ڪيو. هن چيو، ” ڪل ڏرم ئي سناٽن ڏرم آهي. هن يد ۾ سناٽن ڏرم ناس ٿي ويندو، ڪل جون استريون اپوٽر ٿينديون، ورڻسٽر پيدا ٿيندو، جيڪو ڪل گهاٽين کي اندٽ ڪال تائين نرڪ ۾ وٺي وڃڻ لاء ئي ٿيندو آهي.“ ارجن پنهنجي سماجهه مطابق ”سناٽن ڏرم“ جو بچاء جي لاء اٽاولو آهي. هن شري ڪرشن کي منٽ ڪندي چيو تم اسيين سماجههدار ٿي به هي گھور پاپ چو ڪيون؟ مطلب تم شري ڪرشن پاپ ڪرڻ ٿو وڃي. اوگٽئي پاپ کان بچڻ لاء ”مان يد نه ڪندس“ ائين چوندي نراس ئ مايوس ارجن رٿ جي پنهنجين پاسي ۾ ويهي رهيو. كيترا ئ كيترا گيه جي سنگهرش کان پنيان هتي ويو. ٿيڪاڪارن هن اڌياء کي ”ارجن وشاد ڀوگ“ چيو آهي. ارجن موهره جو نشان آهي. سناٽن ڏرم جي لاء اٽاولي ٿيڻ واري انوراڳي، موهره واري ارجن سبب وشاد ڀوگ بٽيو آهي. اهوئي وشاد من کي ٿيو هو.

هڏڍي بहٽ دڻو:خ لاغا، جنم گيئو هری ٻگاتي ٻين رام

” هرديه بُهٽ دکه لڳا، جنم گيئو هري ڀڳتي ٻين ”
 (رام چرت مانس ۱۴۲)

سنسي ۾ پئجي منش دکه (وشاد) ڪري ٿو. هن کي
 ڙڪ هو ته ورڻ سنڪر پيدا ٿيندو، جو نرڪ ۾ وٺي ويندو.
 سناتن ڏرم جو ناس ٿيڻ جو ئي اُنكى ڏکه هو. هاڻي
 ”سندشيم وشاد یوگ“ جو سولو نرنئم هن اڌياء ڄي لاء
 ضروري آهي هاڻي :-

”اوم ٿٽسٽي شريمد ڀڳود گيتا سو اُپندشتسو برهمر
 وديا يام
 یوگ شاستري شري ڪرشن ارجن سنوادي سندشيو شاد
 یوگ نام پر ٿموديائيم“

پھريين اڌياء پورو ٿيو (۱)

هري اوم تت ست